

ડિસેમ્બર 12, 2018

કાઉન્સિલે મેઈન સ્ટ્રીટ માટે LRT રૂટને મંજૂરી આપી, ડાઉનટાઉન રિઈમેજીન્ડને મોકૂફ રાખવામાં આવ્યો

બ્રામ્પટન, ઓન્ટેરિયો – કાઉન્સિલે આજે બ્રામ્પટન ટ્રાન્ઝિટ નેટવર્ક યોજનાના ભાગ તરીકે મેઈન સ્ટ્રીટ માટે લાઈટ રેલ ટ્રાન્ઝિટ (LRT) રૂટને અગ્રતા મંજૂર કરી અને ડાઉનટાઉન રિઈમેજીન્ડ (DR) પ્રોજેક્ટને મોકૂફ રાખ્યો.

LRT દરખાસ્તની ઝાંખીઓમાં નીચેની બાબતો સામેલ છે:

- અન્ડરગ્રાઉન્ડ ટનલિંગ વિકલ્પનો અભ્યાસ અને વિચારણા સહિત, અસલ દ્યુરોન્ટેરિયો-મુખ્ય LRT પર્યાવરણલક્ષી મૂલ્યાંકનમાં જરૂરી કોઈ માહિતી અદ્યતન કરીને બ્રામ્પટન LRT વિસ્તરણ અભ્યાસમાં સુધારો કરવો
- કેનેડી રોડ અને મકલોફ્લિન રોડ માટે ટેકનોલોજી તરીકે બસ રોડ ટ્રાન્ઝિટ (BRT) નો ઉપયોગ કરવો અને તે લાઈનોને આગળ ઉત્તર અને/અથવા દક્ષિણ સુધી વિસ્તારવાનું વિચારવું
- ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટ્રાન્ઝિટ માસ્ટર પ્લાન (TTMP) માં વિચાર્યો પ્રમાણે બ્રામ્પટન GO સ્ટેશનથી મેઈન સ્ટ્રીટ પર મેક્લિડ રોડ સુધી રેપિડ ટ્રાન્ઝિટ વિકલ્પોનો અભ્યાસ કરવો
- ડાઉનટાઉન મોબિલિટી હબ માટે અમલીકરણ વ્યૂહરચના પર ફરીથી અહેવાલ આપવો

DR પ્રોજેક્ટ સંખ્યાબંધ કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે, જેમાં નીચેની બાબતો સામેલ છે:

- ટેન્ડરનો ખર્ચ અંદાજ કરતા વધારે આવ્યો છે
- યુટિલિટીસ (વીજળી, હીટ, પાણી, વગેરે) અને અન્ડરગ્રાઉન્ડ ચેનલના ખર્ચ સંબંધિત અચોક્કસતાઓ
- ડાઉનટાઉનના હાઈમાં નવી વિકાસ યોજનાની તકો
- યુનિવર્સિટી માટે પ્રાંતીય ભંડોળ રદકરણના પરિણામ સ્વરૂપે ડાઉનટાઉનના હાઈમાંના પ્રોજેક્ટ્સમાં સુધારો કરવામાં આવ્યો છે
- DR માટે હાલની ડિઝાઈન કાઉન્સિલના ભૂતપૂર્વ નિર્ણય પ્રમાણે મેઈન સ્ટ્રીટ તરફની LRT ને અશક્ય બનાવે છે

મેયર પેટ્રિક બ્રાઉને કહ્યું, “હું રાજી છું કે આપણાં કરદાતાઓના નાણાં માટે મૂલ્ય પૂરું પાડવા કાઉન્સિલ પોતાના વલણમાં એકમત હતી. “બ્રામ્પટન માટે 2040 નાં વિઝનમાં વર્ણવેલા અમારા સંયુક્ત લક્ષ્યમાં આધુનિક અને અસરકારક LRT નો સમાવેશ થાય છે. આનાથી એ ખાતરી કરવામાં મદદ મળશે કે બ્રામ્પટન GTA પ્રદેશમાં રોકાણ કરવા ઈચ્છતી રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસ્થાઓ પાસેથી ભાવિ આર્થિક રોકાણ આકર્ષી શકે છે – તે એવું કંઈક છે જેની જરૂરિયાત અમને સમૂદ્ધ બ્રામ્પટન માટે પડે છે. ડાઉનટાઉન રિઈમેજીન્ડ પર વિરામ મૂકીને, અમે ખાતરી કરીશું કે અમે પહેલી વાર તેને યોગ્ય રીતે કરીએ છીએ અને કાર્યક્ષમ અને જવાબદાર રીતે આગળ વધીએ છીએ.”

“આ ડાઉનટાઉનમાં આયોજનબદ્ધ તમામ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા અમારા માટે સારી તક છે,” હેરી શ્લેન્જ (Harry Schlange), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રામ્પટને જણાવ્યું. “અમે કેટલીક આગામી પહેલો સાથેનો આવેગ જાળવી રહ્યાં છીએ, અને અમે હવે આપણાં ડાઉનટાઉનના પુનરોદ્ધાર માટે અમારી કટિબદ્ધતા પ્રત્યે સાકલ્યવાદી અભિગમનું આયોજન કરવા વધારે સક્ષમ છીએ.”

કેટલીક ભાવી પહેલોમાં ડાઉનટાઉન ટ્રાન્ઝિટ ટર્મિનલ અને હેરિટેજ થિયેટર બ્લોક અને સાઈબર સુરક્ષા માટેના કેન્દ્રનો સંભવિત પુનઃવિકાસ સામેલ છે.

હાલની પહેલોમાં આ સામેલ છે:

- [સેન્ટર ફોર ઈનોવેશન \(નવીન શોધ માટેનું કેન્દ્ર\)](#)
- [યાંગ સ્કૂલ ઓફ કન્ટિન્યુઈંગ એજ્યુકેશન \(સાઈબર સુરક્ષા પર જન્યુઆરી 2019 થી શરૂ થતા બે અભ્યાસક્રમો\)](#)
- [એક નવું પાઈલોટ ઈનક્યુબેટર હબ \(વસંતઋતુ 2019 માં ખુલવાનું અપેક્ષિત\)](#)
- [અલગોમા યુનિવર્સિટીનું વિસ્તરણ](#)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મેનિકા ડુગ્ગલ (Monika Duggal)

વેબસાઇટનેટવર્ક, મીડીઆ ઍન્ડ વમિઉનિટી ઍનગેજમેન્ટ

સ્ટ્રેટજિક વમિઉનિવેસ્ટ

સિટી ઑફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca